



**યાદશક્તિ ઓછી હોય તેવી વ્યક્તિઓએ પણ શાક તરીકે
ઉપયોગમાં લેવું જોઈએ. ઉન્માદ તથા સ્મૃતિભંશમાં પણ ઉપયોગી
હે. ભૂરું કોળું રક્ત (લોહી)નો સંગ્રહ કરનાર હે તેથી લોહીવા,
દૂષતા મસા, નાકમાંથી પડતું લોહી, જાડામાંથી પડતું લોહી
(રક્તાતિસાર)માં કુખ્યાંડ પાક, કુખ્યાંડ અવલેહ તથા કુખ્યાંડ
ચૂર્ણ મધ્ય સાથે અપાય હે. આચુર્યેદમાં ભૂરું કોળાને શુક્ખધાતુ
વધારનાર, બળ આપનાર અને પુષ્ટિ કરનાર કહેલ હે.**



- ભૂરું કોળાના ફળનો ઉકાળો કરી પઠ એમાંલની માત્રામાં ૧૫ દિવસ સુધી આપવાથી સ્ત્રીયોનિમાંથી સંક્રદ પાણી પડતું હોય અને તેને લીધે દુર્જણતાનો અનુભવ થતો હોય તો મટે હે.
- મસ્તિષ્ક માટે બળકારક તથા વિચારોને શાંત પાડનાર હોવાથી અનિદ્રાના રોગમાં કષયકારક હે. યાદશક્તિ ઓછી હોય તેવી વ્યક્તિઓએ પણ શાક તરીકે ઉપયોગમાં લેવું જોઈએ. ઉન્માદ તથા સ્મૃતિભંશમાં પણ ઉપયોગી હે.
- નાના ગામડાંઓમાં ખાસ કરીને મધ્યપદેશમાં ગાંડપણા વેગ વખતે કોળાના રસમાં મોટા કોલિજનનું ચૂર્ણ ઉમેરીને પીવાવવામાં આવે તો વ્યક્તિ થોડી જ વારમાં શાંત થઈ જાય હે.
- ભૂરું કોળું રક્ત (લોહી)નો સંગ્રહ કરનાર હે તેથી લોહીવા, દૂષતા મસા, નાકમાંથી પડતું લોહી, જાડામાંથી પડતા લોહી (રક્તાતિસાર)માં કુખ્યાંડ પાક, કુખ્યાંડ અવલેહ તથા કુખ્યાંડ ચૂર્ણ મધ્ય સાથે અપાય હે.
- ભૂરું કોળાના રસને સાકર, જેઠીમધ્ય, તજ, તમાલપત્ર, અલચી, નાગકેસર, જીરુ, પીપર માથે મરીના સમનાગે કરેલા ચૂર્ણ સાથે લેળવાને રસ પીવાથી વધુ પડતા

દર્દ પીવાથી ચેઢેલો મદ ઉત્તે હે.

- ભૂરું કોળાનાં બીયાં ઇમ્બિન (ઇમ્બિન માસનાર) હે. ૨-૪ તોલા બીજની ચટણી બનાવી દર્દને આપવો ત્યારબાદ રેથ આપવાથી ઇમ્બિ મરીને બદાર નીકળી જાય હે. ખાસ કરીને સ્ફીટાઇમ્બિ (ટેપવોર્મ્સ) પર વધારે અસર કરે હે.
- આચુર્યેદમાં ભૂરું કોળાને શુક્ખધાતુ વધારનાર, બળ આપનાર અને પુષ્ટિ કરનાર કહેલ હે.
- નાય સંશોધન અનુસાર ભૂરું કોળાના બીયાને દૂધમાં ઉકળીને કે દૂધમાં પાક (હલવો) બનાવીને લેવાથી શુક્ખધાતુ વધે હે અને શુક્ખધાતુ લોકોમોશનમાં વધારો થાય હે.
- બોન ડી. એનસાયકલોપેડિયા ઓફ હર્બ્સ એન્ડ ધેર સુસ. ડોર્લિંગ કિન્ડર્સ લે. લંડન માં જાણાવ્યા અનુસાર ભૂરું કોળાના ફળમાં એન્ટી-કેન્સર ટર્પેન્સ (કેન્સર વિરોધી તત્ત્વ) મળેલા હે.
- ભૂરું કોળાને ચાર રસ્તે મૂક્તાં પહેલાં કરત પૂજણા બોલ તરીકે તેના ઉપયોગોને યાદ કરીને તેનો ઉપયોગ સ્વસ્થ જીવન માટે આપણો કરીએ અને આપણા બાળકોને પણ કરાવીએ તો આપણા માધ્યમુનિઓએ કરેલા સંશોધનોનું આપણે માઝા ચૂકવી શકીશું. એટલું જ નહીં કોળાથી આપણે આપણા શરીરને પણ તંદુરસત કરી શકીશું.